

Date: February 10, 2023

To, The Manager, Listing Department, National Stock Exchange of India Limited (NSE), Exchange Plaza, C – 1, Block – G, Bandra – Kurla Complex, Bandra (E), Mumbai-400 051.	To, The Department of Corporate Service, BSE Limited, 1 st Floor, New Trading Ring, Rotunda Building, Phiroze Jeejeebhoy Tower, Dalal Street, Mumbai – 400 001.
Symbol – LINCOLN	Scrip Code – 531633

Dear Sir,

Sub.: Newspaper Advertisement – Un-Audited Financial Results (Standalone and Consolidated) for the Quarter and Nine Months Ended December 31, 2022.

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclosed herewith the copies of published newspaper advertisement with respect to the un-audited financial results (standalone and consolidated) of the Company for the quarter and nine months ended December 31, 2022. The said advertisement was published in the following newspapers:

- 1) The Economic Times, Ahmedabad Edition - In English;
- 2) Jay Hind, Ahmedabad Edition - In Gujarati.

Kindly take the same on your records.

Thanking you,

Yours faithfully,

For Lincoln Pharmaceuticals Ltd

Trusha K. Shah
Company Secretary &
Compliance Officer

Encl: A/a

Regd. Office : "Lincoln House", Science City Road, Sola, Ahmedabad-380 060. Gujarat, India
Phone : +91-79-4107 8000 | **Fax :** +91-79-4107 8062 | **CIN** L24230GJ1995PLC024288
E-mail : info@lincolnpharma.com | **Website :** www.lincolnpharma.com

Factory : 10, 12, 13, Trimul Estate, Near Khatraj Chokadi, P.O. Khatraj-382721.

Ta. : Kalol, Dist. Gandhinagar, (Guj.) | **Phone :** +91-79-49135000 | **E-mail :** khatraj@lincolnpharma.com



Pure Politics

Doval Calls on Putin in Moscow to Widen Strategic Ties



Dipanjan Roy Chaudhury
@timesgroup.com

New Delhi: National Security Advisor Ajit Doval has called on Russian President Vladimir Putin one on one in Moscow and focused on defence ties & projects, energy and fertilisers supply besides boosting trade in national currencies and connectivity initiatives.

This was one of the rare occasions when a visiting NSA called on Putin in Moscow and this underlines the depth of the relationship, sources told ET. Putin is expected to visit India in June for the SCO Summit and again in September for the G20 Summit.

"It is a rare privilege. Given the turbulent international situation, the meeting indicates that both sides have decided to further deepen their strategic partnership, contrary to expectations that the Russia-Ukraine war would increase the gap between the two countries. The opposite has happened," India's former envoy to Moscow DB Venkatesh Varma told ET.

Doval's visit comes in the backdrop of India and Russia pushing security and energy partnership amid reports of an increase in oil trade and offer to India to join Checkmate fifth-generation fighter jet project. ET was the first to report that Doval will visit Moscow in February. This is India's second visit to Moscow since the Ukraine war.

Russia is reportedly set to offer India a proposal to join Checkmate fifth-generation fighter jet project. Meanwhile, a set of Sukhoi fighter jets are undergoing upgrade in India.

Doval's visit to Moscow that would involve meetings with his Russian also focused on supply of the remaining 20 S-400 systems to India, supply of spare parts for Russian origin defence systems, and civilian space cooperation and clear partnership. Both sides are

hoping to boost trade in national currencies and connectivity initiatives in Eurasia and the Indian Ocean Region.

Russia has emerged as a top export of oil to India. India is buying more Urals crude than before and refiners have also started taking Russian Arctic crude shipped from Murmansk which had previously been going to the European Union.

India has imported about 1.4 million barrels per day (bpd) of oil since the start of December 2022, up from 800,000 bpd on average in 2022 and just 50,000 bpd before the war in Ukraine. Most of the ships transporting Russian crude oil are either Russian-owned - by state-controlled carrier Sovcomflot and its Dubai-based subsidiary Sun Ship Management - or belong to a "shadow fleet".

In Moscow, Doval also participated in a regional dialogue on Afghanistan on Wednesday and called for intensified intelligence and security cooperation between respective States and its agencies to counter Daesh and terror outfits like Lashkar-e-Taiba and JeM.

Port Asset Monetisation Target Set at ₹6,700 cr

Key projects include ₹2k crore berth at Deendayal Port, ₹980 crore container terminal at Haldia, ₹360 crore dry dock in Vadinar

Tiwsh.Mishra
@timesgroup.com

New Delhi: The Centre has set a target of ₹6,700 crore from asset monetisation in the port and shipping sector for FY24.

Key projects that will be taken up as part of this plan include ₹2,000 crore berth at the Deendayal Port (Kandla, Gujarat), ₹980 crore container terminal at Haldia Dock Complex of Shyama Prasad Mookerjee Port (Kolkata, West Bengal), and a ₹360 crore dry dock in Vadinar (Gujarat).

"Next financial year's monetisation plan would include around 20 assets," a senior government official told ET. He said the list could also include some spillover projects from FY23.

The government has managed to raise around ₹5,000 crore so far from asset monetisation in the current fiscal. India has prepared a national monetisation pipeline with assets worth ₹16 lakh crore to be monetised between FY22 to FY25.

As per the National Monetisation Pipeline (NMP), there are 31 projects in nine major ports that would be offered for private sector participation.

sing the burden of managing day-to-day functions," the official said.

The government is also looking to iron out issues in the land leasing policy of ports to better utilise vacant land with Indian ports.

The present land policy of the ports (formulated in 2014-15 and then updated in 2019-20) is perceived as being complicated and a hindrance to monetisation.

The government has managed to raise around ₹5,000 crore so far from asset monetisation in the current fiscal. India has prepared a national monetisation pipeline with assets worth ₹16 lakh crore to be monetised between FY22 to FY25.

The government has managed to raise around ₹5,000 crore so far from asset monetisation in the current fiscal. India has prepared a national monetisation pipeline with assets worth ₹16 lakh crore to be monetised between FY22 to FY25.

The focus, he said, is to add more ports to use land to supplement their role as goods transit hubs. "This will include developing cargo holding facilities among others to better port operations with public private partnership," the official added.



LUX INDUSTRIES LIMITED

CIN : L17309WB1995PLC073053
Regd. Office: 39, KALI KRISHNA TAGORE STREET, KOLKATA - 700 007
Email: info@luxinnerwear.com, Website: www.luxinnerwear.com, Ph: 033-40402121, Fax: 033-40012001

Promises and performances that ensure comfort

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2022

PARTICULARS	STANDALONE					CONSOLIDATED				
	Quarter Ended		Nine Months Ended		Year Ended	Quarter Ended		Nine Months Ended		Year Ended
	31.12.2022	31.12.2021	31.12.2022	31.12.2021	31.03.2022	31.12.2022	31.12.2021	31.12.2022	31.12.2021	31.03.2022
Total Income from Operations (net)	461.35	661.77	1,662.16	1,703.47	2,289.99	462.51	668.01	1,672.52	1,719.96	2,312.92
Net Profit / (Loss) before Exceptional Items and Tax	27.03	137.92	154.44	356.65	459.27	23.96	136.77	147.96	354.72	455.92
Net Profit / (Loss) after Tax Attributable to the Owners of the Company	19.62	103.44	114.09	266.89	341.39	16.56	101.20	107.63	264.96	338.06
Total Comprehensive Income for the Period after Tax (Comprising Profit for the Period and Other Comprehensive Income)	19.75	103.47	114.47	266.99	341.90	16.70	101.24	108.06	265.06	338.64
Equity Share Capital (Face value Rs. 2/- per share)	6.26	6.26	6.26	6.26	6.26	6.26	6.26	6.26	6.26	6.26
Other Equity excluding Revaluation Reserve					1,310.24					1,303.44
Earnings Per Share (Basic & Diluted) (Face value Rs. 2/- per share)**	6.52	34.40	37.94	88.75	113.53	6.01	33.69	36.85	88.43	112.95

* There was no exceptional and extra-ordinary item during the above mentioned period.
** Not Annualised except for the year ended 31st March, 2022

Notes :
1. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on February 09, 2023.
2. The above is an extract of the detailed format of Un-audited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (www.luxinnerwear.com)

By Order of the Board for LUX INDUSTRIES LIMITED
Sd/-
Ashok Kumar Dodi
Chairman
DIN-00053599



HINDUSTAN AERONAUTICS LIMITED

Regd. Office: 15/1, Cuddalore Road, Bengaluru - 560 001
CIN : L35301KA1963GO1001622, TEL : 080 22320001, email : investors@hal-india.co.in website : www.hal-india.co.in

STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER 2022

S. No.	Particulars	Standalone					Consolidated				
		Quarter ended		Nine months ended		Year ended	Quarter ended		Nine months ended		Year ended
		Audited	Audited	Audited	Audited	Audited	Audited	Audited	Audited	Audited	Audited
1	Total Income from Operations	5,66,586	5,89,369	14,43,327	13,06,207	24,62,021	5,66,554	5,89,382	14,43,279	13,06,179	24,62,002
2	Other Income	49,695	19,478	94,984	48,293	96,634	49,718	19,484	94,789	48,137	96,493
3	Total Income	6,16,281	6,08,847	15,38,311	13,54,500	25,60,655	6,16,272	6,08,866	15,38,068	13,54,316	25,60,495
4	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional Items)	1,21,174	1,25,136	3,63,917	2,65,730	5,23,115	1,21,294	1,24,719	3,66,584	2,64,756	5,22,453
5	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional Items)	1,21,174	1,25,136	3,63,917	2,65,730	5,23,115	1,21,294	1,24,719	3,66,584	2,64,756	5,22,453
6	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional Items)	1,15,399	93,755	2,96,987	1,98,454	5,08,650	1,15,519	93,338	2,99,654	1,97,480	5,07,988
7	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,13,985	96,493	3,06,187	2,03,923	5,23,337	1,14,148	96,099	3,08,929	2,03,010	5,22,662
8	Paid-up Equity Share Capital (Face value - Rs.10 each)	33,439	33,439	33,439	33,439	33,439	33,439	33,439	33,439	33,439	33,439
9	Other Equity excluding revaluation reserves	-	-	-	-	18,92,961	-	-	-	-	18,92,874
10	Capital Redemption Reserve	-	-	-	-	14,761	-	-	-	-	14,761
11	Earnings Per Share (Face value of Rs.10/- each) (EPS for the quarter and nine months are not annualised) (in Rs.)										
	(i) Basic	34.51	28.04	88.82	59.35	152.11	34.55	27.91	89.61	59.06	151.92
	(ii) Diluted	34.51	28.04	88.82	59.35	152.11	34.55	27.91	89.61	59.06	151.92
12	Net Worth (including Retained Earning)	-	-	-	-	19,26,400	-	-	-	-	19,31,688

Notes:
1. The above is an extract of the detailed format of quarterly and year to date audited financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly audited financial results are available on the Stock Exchange websites i.e. www.bseindia.com & www.nseindia.com and also on the Company's website www.hal-india.co.in.
2. The Company has prepared these standalone and consolidated financial results in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 prescribed under Section 133 of the Companies Act, 2013.
3. The Statutory Auditors have issued unmodified opinion on the standalone and consolidated financial results of the Company for the quarter and nine months ended 31, December 2022.
4. Figures for the previous periods have been regrouped / reclassified to conform to the classification of the current period, wherever necessary.

Place : Bengaluru
Date : 09.02.2023
CB Ananthkrishnan
Chairman & Managing Director
(Additional Charge)
DIN: 06761339

LINCOLN PHARMACEUTICALS LIMITED

Regd. Office: "LINCOLN HOUSE" Behind Satyam Complex, Science City Road, Soia, Ahmedabad-380060.
CIN: L24230GJ1995PLC024288, Ph. No.: +91-79-4107-8000,
Website: www.lincolnpharma.com, E-Mail: investor@lincolnpharma.com.

Extract of Standalone and Consolidated Un-Audited Financial Results for the Quarter and Nine Months Ended on 31-December-2022.

Sr. No.	Particulars	Standalone					Consolidated				
		Quarter Ended		Nine Months Ended		Year Ended	Quarter Ended		Nine Months Ended		Year Ended
		31-12-22	30-09-22	31-12-21	31-12-21	31-03-22	31-12-22	30-09-22	31-12-21	31-12-21	31-03-22
1	Total Income	14,012.39	14,629.71	12,251.57	41,638.66	37,764.34	48,207.66	14,012.38	14,633.35	12,251.57	41,642.29
2	Net Profit before Tax	3,051.59	3,203.26	2,359.94	8,347.44	7,916.71	9,592.91	3,051.49	3,206.07	2,359.94	8,350.25
3	Net Profit after tax	2,161.31	2,371.29	1,760.19	6,033.76	5,833.13	6,935.50	2,161.21	2,371.29	1,760.19	6,033.76
4	Total Comprehensive Income	2,164.56	2,374.54	1,764.45	6,043.51	5,838.35	6,948.50	2,164.46	2,374.54	1,764.45	5,838.35
5	Paid-Up Capital (FV Rs.10/-)	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97
6	Other Equity					41,284.78					41,284.78
7	EPS (Not Annualised): Basic	10.79	11.84	8.79	30.12	29.12	34.63	10.79	11.84	8.79	30.12
8	EPS (Not Annualised): Diluted	10.79	11.84	8.79	30.12	29.12	34.63	10.79	11.84	8.79	30.12

Notes :
1. The above un-audited financial results of the Company for the quarter and half year ended December 31, 2022 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on Thursday, February 09, 2023. The auditor has carried out an limited review of the said financial results.
2. This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.
3. The above is an extract of the detailed format of quarter and half year ended un-audited financial results as filed with the stock exchange(s) under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of financial results are available on the stock exchange(s) website(s) i.e. www.bseindia.com & www.nseindia.com and on the website of the Company i.e. www.lincolnpharma.com.

For Lincoln Pharmaceuticals Limited
Sd/-
Mahendra G. Patel
Managing Director
(DIN: 00104706)

PLACE: AHMEDABAD
DATE: FEBRUARY 09, 2023

હંડીથી બચવા આખી રાત હીટર ચાલુ રાખ્યું ગૂંગળાઈ જવાને કારણે પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્યો

બિજનોર, તા. ૭ શિયાળાની શરૂઆત થઈ ત્યારથી આખી રાત હીટર ચાલુ રાખવાને કારણે ગૂંગળાઈને મૃત્યુ પામવાના ઘણાં કિસ્સા સામે આવ્યા છે. મંગળવારની રાતે પણ આવી જ એક દુઃખદ ઘટના જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં બની હતી. અહીં રહેતા મૂળ બિજનોરના એક પરિવારે ઠંડીનો સામનો કરવા માટે આખી રાત હીટર ચાલુ રાખ્યું હતું, જેના પરિણામે એક દિવસના બાળક સહિત પરિવારના પાંચ સભ્યોનું નિધન થયું હતું. મૃતકોની ઓળખની વાત કરીએ તો ૩૫ વર્ષીય મોહમ્મદ માજિદ અને તેની પત્ની ૩૦ વર્ષીય શહાનાએ જીવ ગુમાવ્યો છે. સાથે જ તેમના ત્રણ બાળકો કેજાન (સાત વર્ષ), અબુઝર (૫ વર્ષ) અને નવજાત બાળકનું પણ નિધન થયું છે. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ પરિવાર અહીં ભાડાના મકાનમાં રહેતો હતો. પાડોશીઓએ જોયું કે પરિવારના પહેલા જ ભાભીએ બાળકને જન્મ આપ્યો હતો, માટે અમે તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવવા માટે અનેકવાર ફોન કર્યો પણ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તપાસ પછી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે લગભગ ૧૫ વર્ષ પહેલાં માજિદ અને તેમનો પરિવાર બિજનોરના એક ગામથી કાશ્મીરના કાલપોરા વિસ્તારમાં રહેવા માટે આવ્યો હતો. તેના ભાઈ મુક્તી વાજિદ જણાવે છે કે, ઘટના બની તેના એક દિવસ



તુકીમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ માનવતાના ધોરણે બચાવ રાહત કાર્ય માટે પહોંચેલી ભારતીય સેના દ્વારા ભૂકંપગ્રસ્ત હદાય પ્રોવિન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ફિલ્ડ હોસ્પિટલ ઉભી કરવામાં આવેલી દ્રશ્યમાન થાય છે.

જોશીમઠમાં વધુ મકાનોમાં તિરાડો: ૧૫ દિવસ બાદ રાજ્ય સરકારની કબુલાત

દેરાદૂન: ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાના અને ઈમારતો તથા જમીન પર કુદરતી આફતને પણ હુપાવવાનો પ્રયાસ ઉત્તરાખંડના કચ્છ જોખમમાં મુકાયા છે. લગભગ એક સપ્તાહ સુધી મૌન રહ્યા બાદ તંત્રએ સ્વીકાર્યું છે કે શહેરના નવા ક્ષેત્રમાં હવે તિરાડો જોવા મળી છે. જમીન પર નીચે ધપવા લાગતા અનેક ઈમારતો નમી ગઈ છે અને તે ગમે તે ઘડીએ તૂટી પડે શકે છે. ઉત્તરાખંડના કચ્છ પ્રયાગમાં અનેક ક્ષેત્રોમાં જમીનમાં મોટી તિરાડો જોવા મળતા વલીવટીતંત્રએ એ ક્ષેત્રને અસુરક્ષિત જાહેર કર્યા છે જેમાં હવે કુલ પાંચ મકાનો વલીવટીતંત્રને ખાલી કરાયા છે જેમાં અન્ય વિસ્તારોમાં પણ નિરીક્ષણ ટીમ મોકલવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓએ આ તિરાડ તથા જમીનમાં અસંતુલન અંગે સત્તાવાળાઓને જાણ કરી હતી.

બેન્કો-નાણાકીય સંસ્થાઓ દ્વારા વ્યાજ સિવાયના વસુલતા બેંકામ ચાર્જ પર લગામ આવશે ધિરાણ લેનાર પરના દંડાત્મક ચાર્જ મૂળ બાકી રકમમાં ઉમેરી શકાશે નહીં- RBI

મુંબઈ: બેન્ક સહિતની નાણાકીય સંસ્થાઓ તેના લોન ધારકોના વિલંબથી હતા કે ધિરાણની રકમના યુગ્મણ આપવા હતાનો એક રીટર્ન થવા સહિતના સમયે જે ભારેખમ દંડ તથા અન્ય ચાર્જ વસુલ કરે છે તેના પર હવે રીઝર્વ બેન્ક લગામ કરવા જઈ રહી છે. રીઝર્વ બેન્ક તમામ નાણાકીય સંસ્થાઓને તેના ધિરાણ-લેનાર ગ્રાહકો પાસેથી વસુલાતા ચાર્જને વાજબી તથા પારદર્શક રાખવાની તાકીદ કરતા જણાવ્યું કે આ પ્રકરના ચાર્જને બેન્કો માટે આવકનું સાધન બનવું જોઈએ નહીં. બેન્કો ખાતેઘરોને મીનીમમ બેલેન્સ તથા અન્ય રીતે ધરખમ ચાર્જ વસુલે છે અને તેમાં ખાસ કરીને ધિરાણ લેનાર પર જો હમો ધિરાણ આપનાર સંસ્થાઓ દંડાત્મક વ્યાજ- નોટીસ- લીગલ ચાર્જ પણ મૂળ બાકીમાં ભેળવી તમને વ્યાજ કમાય છે: અલગથી દર્શાવી વસુલવા માટે ગાઈડલાઈન આવશે



NOTICE
Notice is hereby given that the Certificate bearing No's 225, Distinctive No. 8043826 to 8043935 of M/s. GMM Pfaudler Limited folio No. 000577 standing in the name(s) of Mr. Babulal Chhotalal Shah joint with Mrs. Vidyaaben Babulal Shah for 110 shares. (old share detail: certificate Nos : 1714 & 3349 & 9621) Distinctive Nos : 1036221 - 1036230 & 1578001 - 1578005 & 2543773 - 2543779, No of share: 10 & 5 & 7
Has have been lost or mislaid and undersigned has/have applied to company to issue duplicate share certificate(s) for the said shares. Any person who has claim in respect of the said shares should lodge such claim with the company at its Registered office within 15 days from this date else the company will proceed to issue duplicate certificate(s).
Name of shareholder(s)
Babulal Chhotalal Shah
Vidyaaben Babulal Shah
Date : 09-02-2023

આયુષ અને આરોગ્ય મંત્રાલયો સંકલિત સ્વાસ્થ્ય અભિગમને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ: સોનોવાલ

નવી દિલ્હી: ૭ કેન્દ્રીય આયુષ મંત્રી સર્ખાનંદ સોનોવાલ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે સફદરજંગ હોસ્પિટલમાં સંકલિત દવા કેન્દ્રનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવિણ પવાર અને આયુષ રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય આયુષ મંત્રી સોનોવાલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ બંને મંત્રાલયો એકીકૃત અભિગમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે" આરોગ્યમંત્રી ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તમામ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં પરંપરાગત સારવાર સાથે પરંપરાગત દવાને જોડતી અભિગમ "સંકલિત દવા" માટે એક અલગ પાંખ સ્થાપવા તરફ કામ કરી રહી છે. સરકારે ધ્યાન, યોગ અને તમામ પાસાઓ અને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા પ્લેટફોર્મ પર ૧,૫૦,૦૦૦ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના કરી છે.

AKSHARCHEM (INDIA) LIMITED

Regd. Office: "Akshar House", Chhatral Kadi Road, Indrad - 382 715, Mehsana.
Tel : +91 2764 233007/08/09/10 Fax : +91 2764 233550
Website: www.aksharchemindia.com, e-mail ID: cs@aksharchemindia.com, CIN: L24110GJ1989PLC012441

LINCOLN PHARMACEUTICALS LIMITED

Regd. Office: "LINCOLN HOUSE" Behind Satyam Complex, Science City Road, Sola, Ahmedabad-380060.
CIN: L24230GJ1995PLC024288, Ph. No.: +91-79-4107-8000,
Website: www.lincolnpharma.com, E-Mail: investor@lincolnpharma.com.

Extract of Standalone and Consolidated Un-Audited Financial Results for the Quarter and Nine Months Ended on 31-December-2022.

Sr. No.	Particulars	Standalone			Consolidated								
		Quarter Ended		Nine Months Ended	Quarter Ended		Nine Months Ended	Year Ended					
		31-12-22	30-09-22	31-12-21	31-12-22	31-12-21	31-03-22	31-12-22	31-12-21	31-03-22			
(Un-Audited)		(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Audited)		
1	Total Income	14,012.39	14,629.71	12,251.57	41,638.66	37,764.34	48,207.66	14,012.38	14,633.35	12,251.57	41,642.29	37,764.34	48,212.10
2	Net Profit before Tax	3,051.59	3,203.26	2,359.94	8,347.44	7,916.71	9,592.91	3,051.49	3,206.07	2,359.94	8,350.25	7,916.71	9,593.93
3	Net Profit after tax	2,161.31	2,371.29	1,760.19	6,033.76	5,833.13	6,935.50	2,161.21	2,371.29	1,760.19	6,033.76	5,833.13	6,935.50
4	Total Comprehensive Income	2,164.56	2,374.54	1,764.45	6,043.51	5,838.35	6,948.50	2,164.46	2,374.54	1,764.45	6,043.51	5,838.35	6,948.50
5	Paid-Up Capital (FV Rs.10/-)	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97	2,002.97
6	Other Equity						41,284.78						41,284.78
7	EPS (Not Annualised): Basic	10.79	11.84	8.79	30.12	29.12	34.63	10.79	11.84	8.79	30.12	29.12	34.63
	EPS (Not Annualised): Diluted	10.79	11.84	8.79	30.12	29.12	34.63	10.79	11.84	8.79	30.12	29.12	34.63

Notes :
1 The above un-audited financial results of the Company for the quarter and half year ended December 31, 2022 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on Thursday, February 09, 2023. The auditor have carried out an limited review of the said financial results.
2 This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.
3 The above is an extract of the detailed format of quarter and half year ended un-audited financial results as filed with the stock exchange(s) under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of financial results are available on the stock exchange(s) website(s) i.e. www.bseindia.com & www.nseindia.com and on the website of the Company i.e. www.lincolnpharma.com.

For Lincoln Pharmaceuticals Limited
Sd/-
Mahendra G. Patel
Managing Director
(DIN: 00104706)

PLACE: AHMEDABAD
DATE: FEBRUARY 09, 2023

ભાજપના સાંસદોને જીવીપ: તા.૧૩ સુધી લોકસભામાં હાજર રહેવા તાકીદ

નવી દિલ્હી તા.૯ લોકસભામાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ બાદ વિપક્ષને આજે રાજ્યસભામાં પણ શ્રી મોદીના રાષ્ટ્રપતિ ભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ સાંભળવો પડશે પરંતુ તા.૧૩ કેન્દ્ર સુધી ચાલનારી સંસદમાં હાજરી આપવા માટે ભાજપ તેના તમામ સાંસદોને જીવીપ આપ્યો છે. ગઈકાલે મોદીના જવાબ સિવાય લોકસભા અને રાજ્યસભામાં ભાજપના સાંસદોની ગેરહાજરી જોવા મળતી હતી અને ખુદ વડાપ્રધાન તેની નોંધ લીધી છે તથા હવે તમામ સાંસદોને બંને સભા પ્રથમ તબક્કાની તા.૧૩ના રોજ પૂર્ણાહુતિ સુધી હાજરી આપવા માટે જીવીપ આપ્યો છે.

RO JEWELS LIMITED
Address : Ground Floor, Hallmark4 Complex, Hari Bhakti ni Pole, Opp. B. D. College, Shankdi Sheri, Manekchowk, Ahmedabad GJ 380001 IN || CIN : L74999GJ2018PLC105540
EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON DECEMBER 31, 2022 (Rs. in Lakhs)

Sr. No.	Particulars	Quarter ended 31-12-2022 Unaudited	9 Months ended 31-12-2022 Unaudited	9 Months ended 31-12-2021 Unaudited	Half Year ended 30-09-2022 Unaudited	Half Year ended 30-09-2021 Unaudited	Year ended 31-03-2022 Audited
1	Total Income	10492.11	13564.03	-	3071.92	1580.84	4979.36
2	Net Profit for the year before tax	44.94	50.23	-	5.29	10.01	20.51
3	Net Profit for the year after tax	35.94	40.23	-	4.29	9.91	17.51
4	Total Comprehensive Income for the year						
5	Paid up Equity Share Capital	1,008.93	1,008.93	-	1,008.93	1,008.93	1,008.93
6	Other Equity Excluding Revaluation Reserve	-	-	-	-	-	-
7	Earnings per share (Face Value of Rs.10/- each) Basic & Diluted	0.36	0.40	-	0.04	0.10	0.17

TIRUPATI FOAM LIMITED

CIN NO: L25199GJ1986PLC009071
Regd. Off.: Tirupati House, 4th Floor, Nr. Topaz Restaurant, Uni. Road, Polytechnic Char Rasta, Ambawadi, Ahmedabad - 380 015 Ph: 079-26304652/53, Fax No. : 079-26304658 Website: www.tirupatifoam.com
STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER ENDED 31st DECEMBER, 2022 (AMOUNT IN LAKHS)

Sr. No.	Particulars	Quarter Ended			Year to End		
		Unaudited Quarter Ended 31/12/2022	Unaudited Quarter Ended 30/09/2022	Unaudited Quarter Ended 31/12/2021	Unaudited Quarter Ended 31/12/2022	Unaudited Quarter Ended 31/12/2021	Audited Year Ended 31/03/2022
1	Total Revenue (a+b)	2,730.35	2,575.76	3,342.09	7,764.46	7,217.19	10,294.28
2	Total Expenses	2,644.34	2,513.69	3,247.60	7,549.15	7,115.07	10,040.76
3	Profit (Loss) before exceptional items and tax	86.01	62.08	94.50	215.31	102.12	253.52
5	Profit (Loss) before Taxes	86.01	62.08	94.50	215.31	102.12	253.52
6	Tax Expenses						
7	Net Profit / (Loss) from ordinary activities after tax (5-6)	23.49	17.92	20.55	59.59	22.06	70.91
8	Total Other Comprehensive Income	0.41	0.41	0.37	1.24	1.11	1.65
9	Total Comprehensive Income for the period (7+8)	62.92	44.57	74.31	156.96	81.18	184.26
10	Paid up Equity Share Capital (face value of Rs. 10/- each)	440.07	440.07	440.07	440.07	440.07	440.07
11	Earning per share (before extra ordinary items) (of Rs. 10/- each):						
	Basic	1.42	1.00	1.68	3.54	1.82	4.15
	Diluted	1.42	1.00	1.68	3.54	1.82	4.15

Note: The above is an extract of the detailed Unaudited Financial Results for quarter ended on December 31st, 2022 filed with BSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015. The format of the Financial Results are available of the stock exchange website at www.bseindia.com and also on Company's website www.tirupatifoam.com
For, Tirupati Foam Limited
Sd/-
Roshan Sanghvi
Managing Director
Place: Ahmedabad
Date: 09.02.2023

